

## ઓનલાઇન પ્રવેશ માટેની અગત્યની સૂચનાઓ

- ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે નીચે જણાવેલ સ્ટેપ મુજબ ફોર્મ ભરવાનું રહેશે.

1. Registration
2. Sign In
3. Pay Fees
4. Form Entry
5. Document Uploads
6. Print Form

### 1) Registration:

- પ્રવેશાર્થીએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- પ્રવેશાર્થીએ પોતાનું નામ 10<sup>th</sup> અથવા 12<sup>th</sup> ની માર્કશીટમાં દર્શાવેલ નામ/સ્પેલિંગ મુજબ ભરવાનું રહેશે.
- પ્રવેશાર્થીએ જાતિ અને કોર્સ પસંદ કરવાનો રહેશે.
- પ્રવેશાર્થીએ જે વિષયમાં સ્નાતક થવું હોય તે મુજબ મુખ્ય વિષય પસંદ કરવાના રહેશે.
- પ્રવેશાર્થી ફીશીપ કાર્ડ ધરાવતો હોય તો 'Yes' વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- પ્રવેશાર્થીએ મેળવેલ માહિતી પુસ્તિકામાં આપેલ User Name & password થી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તેમાં કોર્સ, વર્ષ, નામ અને ફીશીપ કાર્ડના વિકલ્પમાં એક જ વખત સુધારો કરી શકશે તેથી ચોકસાઈપૂર્વક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

### 2) Sign In

- પ્રવેશાર્થી યુનિવર્સિટી/કેન્દ્ર દ્વારા મેળવેલ માહિતી પુસ્તિકામાં આપેલ User Name & Password થી જ Sign In કરી શકશે.
- SY/TY/M.A-II/SEM-2, 3, 4, 5, 6/YR-2 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સિસ્ટમ દ્વારા On-screen User Name & Password મેળવી શકાશે, જેનાથી Sign In કરી શકશે.
- Sign In કરતા પહેલા પ્રવેશાર્થીએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- પ્રવેશાર્થી પોતાનો Password બદલી શકશે જેમાં પ્રવેશાર્થી જૂનો Password આપી નવો Password Set કરી શકશે.

### 3) Pay Fees

- 1)SBI Collect : જો પ્રવેશાર્થીએ SBI Collect થી ફી ભરવી હોય તો આપેલ મેનુમાંથી 'SBI Collect' પર ક્લિક કરી 'Gujarat' વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ 'Educational Institution' વિકલ્પ પસંદ કરી 'Dr. Babasaheb Ambedkar Open University'નો વિકલ્પ પસંદ કરો. જેમાં 'Course-

Category' પસંદ કરવાની રહેશે. ત્યારબાદ SBI કે અન્ય બેંકના નેટ બેંકીંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી ફી ભરી શકાશે. જેની રીસીપ્ટની પ્રિન્ટ કાઢવાની રહેશે.

2)E-Challan : જો પ્રવેશાર્થીએ e-Challan થી ફી ભરવી હોય તો આપેલ મેનુમાં 'Pay Fees' પર ક્લિક કરી e-Challan પર ક્લિક કરવાનું રહેશે. જેનાથી e-Challan ની PDF On Screen જોઈ શકાશે. જેમાં પ્રવેશાર્થીએ પોતાનું નામ, કોર્સની ફી વગેરે વિગતોની ચકાસણી કરવાની રહેશે. જો ભરેલ વિગતમાં ક્ષતિ ન હોય તો તેની પ્રિન્ટ કાઢવાની રહેશે તથા નજીકની SBIની શાખામાં જઈ e-Challan માં દર્શાવેલ કોર્સ મુજબની ફી રોકડેથી ભરવાની રહેશે.

#### 4) Form Entry

- પ્રવેશાર્થીએ માહિતી પુસ્તિકામાં આપેલ કોર્સ પ્રમાણે સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે.
- પ્રવેશાર્થીએ પોતાનું પૂરું સરનામું (ઘર નંબર, સોસાયટી/મહોલ્લો/એરિયા, શહેર, જિલ્લો, પીન કોડ અને મોબાઈલ નંબર) વગેરે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
- પ્રવેશાર્થીએ પોતાની Personal Details માં Birthdate, Religion, Blind, Handicap, Sex, Professional, Income વગેરે વિગત ભરવાની રહેશે.
- પ્રવેશાર્થીએ પોતાની છેલ્લી પરીક્ષા પાસ કરેલ ડીગ્રીની સંપૂર્ણ માહિતી, જેમ કે Board/University/Year/Seat No/Percentage વગેરે વિગત ભરવાની રહેશે.
- પ્રવેશાર્થીએ CTE/DCH/B.A./B.Com. અભ્યાસક્રમમાં Subject નું સિલેક્શન કરવાનું રહેશે.
- પ્રવેશાર્થીને Payment અંગેનો જે વિકલ્પ પસંદ કરેલ હશે તે સિલેક્ટ કરી તેની વિગત (જનરલ નંબર, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ) ભરવાની રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ પ્રવેશાર્થીએ Save બટન પર ક્લિક કરવાનું રહેશે.

#### 5) Document Uploads:-

- પ્રવેશાર્થીએ Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અપલોડમાં જઈ સ્કેન કરેલ ડોક્યુમેન્ટ (ફોટો, સહી, માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રીસીપ્ટ) અપલોડ કરવાના રહેશે. (ફોટો અને સહીની size 20kb તથા માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રીસીપ્ટની size 100kb થી 150kb સુધીની અપલોડ કરવાની રહેશે.)
- પ્રવેશાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટ્સ ફરજિયાત અપલોડ કરવાના રહેશે.
- જે પ્રવેશાર્થી SC/ST કેટેગરી ધરાવતા હોય તેમણે કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.

#### 6) Print form :-

- પ્રવેશાર્થીએ Print Form આપતા પહેલા તમામ વિગતો ચેક કરવાની રહેશે.
- પ્રવેશાર્થી Final-Submission પહેલા ફોર્મમાં સુધારો કરી શકશે.

- પ્રવેશાર્થીએ ત્યારબાદ Final-Submission બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પ્રવેશાર્થીએ E-Admission Form પ્રિન્ટ કરી તેની સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી પસંદ કરેલ સ્ટડી સેન્ટર પર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
- માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- કાસ્ટ સર્ટિફિકેટ
- ફીની રીસીપ્ટ